

**પત્રક ભાગ-૧**  
**કાર્યવાહીની ટૂંકી નોંધ**  
**ચૌદમી ગુજરાત વિધાનસભા**  
**છકું સત્ર**  
**શુક્રવાર, તા. ૨૦મી માર્ચ, ૨૦૨૦**  
**માનનીય અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષસ્થાને**  
**સભાગૃહ સવારના ૧૦.૦૦ વાગ્યે મળ્યું.**

**૧. તારાંકિત પ્રશ્નોત્તરી**

શુક્રવાર, તા. ૨૦મી માર્ચ, ૨૦૨૦ના રોજની તારાંકિત પ્રશ્નોત્તરીની યાદીમાંના પ્રશ્નો અગ્રતાક્રમ- ૩, ૪, ૯, ૧૨, ૧૭, ૧૮ અને ૨૧ના મૌખિક જવાબ આપવામાં આવ્યા.

ગેરહાજર રહેલ સભ્યશ્રીઓના પ્રશ્નોના અગ્રતાક્રમ- ૧, ૨, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮ અને ૨૦ને અતારાંકિત ગણવામાં આવ્યા.

રાજીનામા આપેલ સભ્યશ્રીઓના પ્રશ્નો અગ્રતા ક્રમ-૫૮, ૧૨૯, ૧૬૯, ૧૮૪ અને ૨૩૪ ૨૬ કરવામાં આવ્યા.

સમયના અભાવે પૂછી ન શકાયેલા તારાંકિત પ્રશ્નો અગ્રતાક્રમ ૨૨થી ૨૮૩(પૈકી ૨૬ સિવાયના)ને અતારાંકિત ગણવામાં આવ્યા.

પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧.૦૦ વાગ્યે પૂરો થયો.

**૪. માગણીઓ પર ચર્ચા અને મતદાન (આઠમો દિવસ)**

વનને લગતી સેવા અંગેની વન અને પર્યાવરણ વિભાગની મહેસૂલી અને મૂડી ખર્ચ માટેની માગણી ક્રમાંક-૨૬, અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણને લગતી સેવા અંગેની આદિજાતિ વિકાસ વિભાગની મહેસૂલી અને મૂડી ખર્ચ માટેની માગણી ક્રમાંક-૯૩, આદિજાતિ વિસ્તાર પેટા યોજનાને લગતી સેવા અંગેની આદિજાતિ વિકાસ વિભાગની મહેસૂલી અને મૂડી ખર્ચ માટેની માગણી ક્રમાંક-૯૬ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી સેવા અંગેની મહિલા અને બાળ વિકાસ વિભાગની મહેસૂલી ખર્ચ માટેની માગણી ક્રમાંક-૧૦૫ માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ રજૂ કરી.

માગણી ક્રમાંક-૨૬, ૯૩, ૯૬ અને ૧૦૫ ઉપરની કાપ દરખાસ્તો વિપક્ષના સભ્યશ્રીઓ સભાગૃહમાં હાજર ન હોવાથી એકપણ કાપ દરખાસ્ત સભાગૃહમાં રજૂ થઈ નહીં.

ત્યારબાદ નીચેના સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધો.

- |                              |                           |
|------------------------------|---------------------------|
| (૧) શ્રી ગોવિંદભાઈ પટેલ      | (૬) શ્રી રમેશભાઈ કટારા    |
| (૨) શ્રી અરવિંદ છો.પટેલ      | (૭) શ્રી શૈલેષભાઈ ભાભોર   |
| (૩) ડો.આશાબેન પટેલ           | (૮) શ્રી સુરેશભાઈ ઘ.પટેલ  |
| (૪) શ્રી જીગ્નેશકુમાર મેવાણી | (૯) શ્રીમતી ઝંખનાબેન પટેલ |
| (૫) શ્રી અભેસિંહ તડવી        | (પ્રવચન અધૂરું)           |

**વિરામ બપોરના ૧૨.૦૦ થી ૧૨.૩૦**

માનનીય સભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલે પોતાનું અધૂરું રહેલ પ્રવચન પૂર્ણ કર્યા બાદ નીચેના વધુ સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધો.

- (૧૦) શ્રી કુબેરભાઈ ડીંડોર  
(૧૧) શ્રી નરેશભાઈ પટેલ  
(૧૨) શ્રી પૂર્ણેશ મોદી

ત્યારબાદ વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ચર્ચાનો જવાબ માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આપ્યો.

**માગણી ક્રમાંક-૨૬, ૯૩, ૯૬ અને ૧૦૫ મત ઉપર મૂકવામાં આવી અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો.**

**સભાગૃહ, સોમવાર, તા. ૨૩મી માર્ચ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨.૦૦ વાગ્યે**

**ફરી મળવા માટે બપોરના ૨.૧૭ વાગ્યે મુલતવી રહ્યું.**

ગુજરાત વિધાનસભા સચિવાલય,  
ગાંધીનગર.  
તા. ૨૦મી માર્ચ , ૨૦૨૦

ડી.એમ.પટેલ  
સચિવ,  
ગુજરાત વિધાનસભા.